https://archive.org/details/bk914/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

જાગો પાટીદાર

(હવે નહી તો ક્યારેય નહી)

તા. ૧૫-૦૩-૨૦૧૩

અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજ ના માજી ટ્રસ્ટી સ્વ. અરજણ લાલજી છાભૈયા ના ધર્મ પત્નિ વનીતાબેન (વાલુ મા), (ઉમર વર્ષ ૬૫) ગામ દરશડી, હાલે બોરીવલી, મુંબઈ, ફોન નં.: ૦૯૮૨૦૭૩૮૧૮૦

આ ઉમરે આપણી સમાજની આવી સ્થિતિ જોવી પડશે એવું મેં ધાર્યુ નહોતું. આ શું થઈ રહ્યું છે આપણી સમાજ માં ? આ જોઈ ને સમાજના ઉપરી ને બે કડવા વેણ કહેવાનું મન થઈ જાય છે.

આજની સમાજની પરિસ્થિતી થી દીકરીઓને જે સહન કરવાનું આવ્યું છે. તે છેલ્લા બે-ત્રણ વર્ષો થી વિચાર માત્ર થી મારૂ હૃદય ભરાઈ આવે છે.

આપણે આપણી મરજી થી આપણાજ સનાતન ભાઈઓ તથા વડીલો ની હાજરીમાં અગ્નિ સાક્ષિએ આપણી દીકરીઓને સતપંથી ભાઈઓ ને ત્યાં પ્રેમથી વળાવેલી છે. નથી કોઈ ભાગીને ગઈ. છતાં પણ આપણે નિયાણીઓ તરીકે પુજતા આપણી દીકરીઓને પ્રસંગ સમયે રડાવી, દુ:ખ પહોંચાડવાનું એવું કૃત્ય કરી રહ્યા છીએ કે આ દીકરીઓ અને ભગવાન આપણને કયારેય માફ નહી કરે. અને હવે મારાથી રહેવાતું નથી. હું મારા સનાતની ભાઈઓને કહું કે વધુ તેજ મને સમાજાતું નથી. પણ એક વાત ચોક્કસ છે કે આપણી સમાજની કોઈ પણ દીકરી ઓ પરનો માનસિક અત્યાચાર હવે હું સહન નહી કરું અને સ્ત્રી ની વેદના સ્ત્રી નહીં જાણે તો કોણ જાણશે ? એટલે હું સમાજની દરેક બહેનો ને સંદેશો આપું છું કે હવે **જાગો** અને હવે અપમાન કે અત્યાચાર દીકરીઓ ઉપર આપણા ભાઈઓજ કરે છે. તેને કહીએ કે બંધ કરે. આ વિનંતી સમજે કે ચેતવણી.

ઘોર કળીયુગ પ્રવેશી ગયો છે આપણી સમાજમાં તે વિચારોને લાત મારીને કાઢો બહાર. નહી તો આપણી સમાજ ને ભરખી જશે.

મામેરા આપવા જાઓ તો જમવાનું નહી. સમાજવાડી ની બહાર ઉભા રહેવું. ધંધાકીય આર્થિક વ્યવહાર કરવા નહી, કયારેય એ જાણવાની કોશિષ કરી છે આ કટ્ટરવાદી સનાતની ભાઈઓએ કે મા-બાપ ઉપર શું વિતતુ હશે ? એક જ મા ના પેટે થી જન્મ લેનાર દીકરો સનાતનમાં, દીકરી સંતપંથી ભાઈને ત્યાં વળાવી અને તેમના પરિવારના પ્રસંગો માં યુવાસંઘ ના અણ સમજુ નબીરાઓ કડક થઈને ઉપર થી આદેશ છે. આમ ન કરવું, તેમ ન કરવું, કોણે કાઢ્યા છે આ આદેશો, બનાવો લીસ્ટ, ખબર પડે. કયાંથી સડો ધુસી રહ્યો છે આ સમાજમાં જેમની પાસે આદેશો ની કોપી હોય તો આપજો મને જાણ તો થાય. નામો તો ખબર પડે.

કેન્દ્ર સમાજના પ્રમુખ આપણા માવિત્ર છે તેમને સમજણ નથી પડતી કે તમે આપણી સમાજને પતન ના માર્ગે લઈ જાઓ છો. હાલ માં સમાજની દાંટ વળી રહી છે તેના જવાબદાર તમે જ છો. શું આ સમાજ તમારી કે આ પાંચ-પંદર માણસોની જાગીર છે ? શું સમજો છો તમારા મનમાં ?

જે વડીલો પ્રત્યે આપણને માન ઉપજે તેઓ પણ આ કળિયુગ ના ચક્કરમાં ફસાઈ ગયા છે. જેઓના કહેવાથી ડોમ્બીવલી સમાજ વાડીના નિર્માણ કાર્યમાં સતપંથી ભાઈઓ પાસે થી ફાળો લીધો છે અને આજ વડીલો નવી સમાજ બનાવીને સમાજમાં ઝગડા ના મુળ નાખી, સતપંથી ભાઈઓને સમાજમાંથી અલગ કરવાની પેરવી તેજ ડોમ્બીવલી સમાજવાડીમાં કરી રહ્યા છે. લક્ષ્મી નારાયણ ભગવાન આવા વડીલોને સદ્બુદ્ધિ આપે.

કોઈ કહેતા નથી એટલે પાંચ-પંદર જણા મળીને નવી સમાજનું નિર્માણ કરો છો અને તે પણ આ વિવાદોના સમયે. સમાજનો અભિપ્રાય તો લો, ફકત ત્રણ-ચાર ટકા લોકો આ સમાજ ને તોડવા બેઠા છો કે શું ? મુંબઈ ટ્રસ્ટ ફંડ તમારા પાપાચરણ માં સહમત ન થયું એટલે એમની સામે નવી સમાજ બનાવી રહ્યા છો.

વીસ વીસ વર્ષોથી માંડવી હોસ્ટેલનું કાર્ય કેટલું સરસ રીતે થઈ રહ્યું હતું. તેમાં ખલેલ નાખી ખોટો પ્રચાર કરી વડીલોને રડાવ્યા, અરે જરા સમજો તો ખરા, આપણને તે ત્યાં સ્કુલ બનાવી છે અને પ્રાયવેટ સ્કુલમાં ખર્ચા વધી જાય

realpatidar.com

https://archive.org/details/bk914/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk914/page/n2/mode/1up

2013-03-15 -Valuma -Jago Patidar (914)

realpatidar.com

જાગો પાટીદાર

(હવે નહી તો ક્યારેય નહી)

તા. ૧૫-૦૩-૨૦૧૩

અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજ ના માજી ટ્રસ્ટી સ્વ. અરજણ લાલજી છાભૈયા ના ધર્મ પત્નિ વનીતાબેન (વાલુ મા), (ઉમર વર્ષ ૬૫) ગામ દરશડી, હાલે બોરીવલી, મુંબઈ, ફોન નં.: ૦૯૮૨૦૭૩૮૧૮૦

આ ઉમરે આપણી સમાજની આવી સ્થિતિ જોવી પડશે એવું મેં ધાર્યું નહોતું. આ શું થઈ રહ્યું છે આપણી સમાજ માં ? આ જોઈ ને સમાજના ઉપરી ને બે કડવા વેણ કહેવાનું મન થઈ જાય છે.

આજની સમાજની પરિસ્થિતી થી દીકરીઓને જે સહન કરવાનું આવ્યું છે. તે છેલ્લા બે-ત્રણ વર્ષો થી વિચાર માત્ર થી મારુ હૃદય ભરાઈ આવે છે.

આપણે આપણી મરજી થી આપણાજ સનાતન ભાઈઓ તથા વડીલો ની હાજરીમાં અગ્નિ સાક્ષિએ આપણી દીકરીઓને સતપંથી ભાઈઓ ને ત્યાં પ્રેમથી વળાવેલી છે. નથી કોઈ ભાગીને ગઈ. છતાં પણ આપણે નિયાણીઓ તરીકે પુજતા આપણી દીકરીઓને પ્રસંગ સમયે રડાવી, દુ:ખ પહોંચાડવાનું એવું કૃત્ય કરી રહ્યા છીએ કે આ દીકરીઓ અને ભગવાન આપણને ક્યારેય માફ નહી કરે. અને હવે મારાથી રહેવાતું નથી. હું મારા સનાતની ભાઈઓને કહું કે વધુ તેજ મને સમાજાતું નથી. પણ એક વાત ચોક્કસ છે કે આપણી સમાજની કોઈ પણ દીકરી ઓ પરનો માનસિક અત્યાચાર હવે હું સહન નહી કરું અને સ્ત્રી ની વેદના સ્ત્રી નહીં જાણે તો કોણ જાણશે ? એટલે હું સમાજની દરેક બહેનો ને સંદેશો આપું છું કે હવે **જાગો** અને હવે અપમાન કે અત્યાચાર દીકરીઓ ઉપર આપણા ભાઈઓજ કરે છે. તેને કહીએ કે બંધ કરે. આ વિનંતી સમજે કે ચેતવણી.

ઘોર કળીયુગ પ્રવેશી ગયો છે આપણી સમાજમાં તે વિચારોને લાત મારીને કાઢો બહાર. નહી તો આપણી સમાજ ને ભરખી જશે.

મામેરા આપવા જાઓ તો જમવાનું નહી. સમાજવાડી ની બહાર ઉભા રહેવું. ધંધાકીય આર્થિક વ્યવહાર કરવા નહી, ક્યારેય એ જાણવાની કોશિષ કરી છે આ કટ્ટરવાદી સનાતની ભાઈઓએ કે મા-બાપ ઉપર શું વિતતુ હશે ? એક જ મા ના પેટે થી જન્મ લેનાર દીકરો સનાતનમાં, દીકરી સંતપંથી ભાઈને ત્યાં વળાવી અને તેમના પરિવારના પ્રસંગો માં યુવાસંઘ ના અણ સમજુ નબીરાઓ કડક થઈને ઉપર થી આદેશ છે. આમ ન કરવું, તેમ ન કરવું, કોણે કાઢ્યા છે આ આદેશો, બનાવો લીસ્ટ, ખબર પડે. ક્યાંથી સડો ઘુસી રહ્યો છે આ સમાજમાં જેમની પાસે આદેશો ની કોપી હોય તો આપજો મને જાણ તો થાય. નામો તો ખબર પડે.

કેન્દ્ર સમાજના પ્રમુખ આપણા માવિત્ર છે તેમને સમજણ નથી પડતી કે તમે આપણી સમાજને પતન ના માર્ગ લઈ જાઓ છો. હાલ માં સમાજની દાંટ વળી રહી છે તેના જવાબદાર તમે જ છો. શું આ સમાજ તમારી કે આ પાંચ-પંદર માણસોની જાગીર છે ? શું સમજો છો તમારા મનમાં ?

જે વડીલો પ્રત્યે આપણને માન ઉપજે તેઓ પણ આ કળિયુગ ના ચક્કરમાં ફસાઈ ગયા છે. જેઓના કહેવાથી ડોમ્બીવલી સમાજ વાડીના નિર્માણ કાર્યમાં સતપંથી ભાઈઓ પાસે થી ફાળો લીધો છે અને આજ વડીલો નવી સમાજ બનાવીને સમાજમાં ઝગડા ના મુળ નાખી, સતપંથી ભાઈઓને સમાજમાંથી અલગ કરવાની પેરવી તેજ ડોમ્બીવલી સમાજવાડીમાં કરી રહ્યા છે. લક્ષ્મી નારાયણ ભગવાન આવા વડીલોને સદ્‌બુદ્ધિ આપે.

કોઈ કહેતા નથી એટલે પાંચ-પંદર જણા મળીને નવી સમાજનું નિર્માણ કરો છો અને તે પણ આ વિવાદોના સમયે. સમાજનો અભિપ્રાય તો લો, ફક્ત ત્રણ-ચાર ટકા લોકો આ સમાજ ને તોડવા બેઠા છો કે શું ? મુંબઈ ટ્રસ્ટ ફંડ તમારા પાપાચરણ માં સહમત ન થયું એટલે એમની સામે નવી સમાજ બનાવી રહ્યા છો.

વીસ વીસ વર્ષોથી માંડવી હોસ્ટેલનું કાર્ય કેટલું સરસ રીતે થઈ રહ્યું હતું. તેમાં ખલેલ નાખી ખોટો પ્રચાર કરી વડીલોને રડાવ્યા, અરે જરા સમજો તો ખરા, આપણને તે ત્યાં સ્કુલ બનાવી છે અને પ્રાયવેટ સ્કુલમાં ખર્ચો વધી જાય

realpatidar.com

https://archive.org/details/bk914/page/n3/mode/1up

realpatidar.com

અને તે બોજો સમાજ ઉપર આવે. તેમાં સરકારી રાહત મળે, ગ્રાન્ટ મળે તે હેતુ થી ટ્રસ્ટ કરવું જરૂરી હતું અને તે ટ્રસ્ટીઓએ કેન્દ્ર સમાજની પરવાનગી લીધી નહી (તે ગત્ પાટીદાર સંદેશ ના તંત્રી સ્થાનેથી ખુલાસો આપેલ છે.) બસ એટલી જ એમની ભુલ. અને તેનો પ્રચાર કેટલી હદે ખોટી રીતે કરી નાખ્યો અને આ કટ્ટરવાદીઓ સમાજને પૂછ્યા વગર નવી નવી સમાજો બનાવે છે તે હક આપ્યા છે કોણે તેતો કહો ?

આપણી કચ્છ કડવા પાટીદાર સમાજમાં જે થઈ રહ્યું છે તે લગભગ ૯૮% લોકોને નથી ગમતું. તો હવે બધાએ બોલવું પડશે નહી તો આપણે જ આ પરિસ્થિતી ના જવાબદાર કે ગુનેગાર થઈશું. આ થોડાક લોકોને સમાજમાંથી જ બહાર કાઢવા પડશે. નહીતો આ સમાજમાં ઝગડા ઓ સિવાય કંઈજ નહી રહે. આપણે સનાતની ઓ જ અંદર અંદર ઝગડતા રહેશું. તે હું તમને કોરા કાગળ ઉપર લખી આપુ. એટલે હવે ચેતી જાઓ.

યુવા સંઘ તમે મારા દિકરાઓ જેવા છો તમને હું હાથ જોડી વિનંતી કરૂં છું કે તમે આપણી સમાજની કરોડ રજ્જુ સમાન છો. તમારી ઉપર આપણી સમાજનું ભવિષ્ય છે. એટલે પહેલા સમજો, તમારી બુધ્ધિ લગાડો, ભાડાની બુધ્ધિ વાપરવાનું બંધ કરો. ધર્મની વાતો, વિવાદોથી સમાજ તો શું આખા દેશના દેશ હોમાઈ જાય છે. હવે ધર્મની વાતો છોડી વિકાસના કાર્યો માં ધ્યાન આપો અને આવા વિવાદોના સમયે નવી સમાજ ના સભ્ય બનવા ના રૂા. ૨૦/- આપવા કરતા, ગરીબો ને વડા પાંઉ ખવડાવી એક ટાઈમ નો પેટનો ખાડો પુરી વધારે પુણ્ય કમાશો, નહી તો વીસ-વીસ જન્મ-મરણ ના ફેરા ના ચક્કરોમાં પડી જશો. તે ખબરે નહી પડે. બસ ઉપર થી આદેશો છે. ઉપર છે કોણ નામ તો આપો.

મુંબઈ કે મુંબઈ ની બહાર જે દિકરીઓને ત્યાં પ્રસંગો આવે છે તેમાં કોઈ એ ડર કે ચિંતા રાખવી નહી. તમારા પ્રસંગો ખરાબ કરવા નહી, ઉપર થી કોઈ એવા આદેશો નથી અને આદેશ હોય તો પાળવા નહી અને હવે જો તમે તમારો પ્રસંગ ખરાબ કરવા દેશો તો તમે જ તેના ગુનેગાર થશો, તમને કોઈ કંઈ કહેવા આવે કે ધમકી આપવા આવે તો મારો ફોન નંબર આપજો અને નજીકના પોલીસ સ્ટેશન થી મારી સાથે વાત કરાવજો. જેમને ત્યાં પ્રસંગો આવતા હોય અને કુટુમ્બીઓ હાજરી આપવાની ના પાડતા હોય તો અમને જાણ કરશો તો હું (અમે) તમારો પરિવાર બની તમારા પ્રસંગો માં હાજરી આપશું. કોલ્હાપુર ની જેમ આર્થિક વ્યવહાર કરવા નહી, લગ્ન પ્રસંગે બોલાવા નહી, એમ કોઈપણ નડવાની કોશિષ કરે તો મને જાણ કરશો.

અને સતપંથી ભાઈઓને વિનંતી કરુ છું કે આપણી સમાજમાં જે પણ કેસો થયા છે કે મજબુરી થી કરવા પડ્યા છે તે વહેલી તકે તેમાંથી ઉકેલ નો રસ્તો કાઢશો. તો આપણી સમાજની એકતા વધારે મજબુત બની જશે.

કેન્દ્રીય સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો એટલુ સમજી લેજો કે હવે જો સમાધાન ના માર્ગ ન અપનાવ્યા તો અમે બધી બહેનો ભેગી થઈ નખત્રાણા પહોંચી આવશું.

લી. વનીતાબેન (વાલુમા) ના હરી ૐ

realpatidar.com